

**B.Ed. Semester - 1 (CBCS) Examination  
January - 2019 (Old Course)**

**ELEMENTS OF ACCOUNT (SELF STUDY COURSE)**

**Time: 2:30 Hours**

**Marks: 35**

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- 
- પ્રશ્ન-૧ નીચેના પ્રત્યેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (૦૮)
- (1) મિલકતના પ્રકારો જણાવો.
  - (2) ખાસ આમનોંધમાં કયાં પ્રકારના વ્યવહારો નોંધાય છે?
  - (3) કાચા સરવૈયાનાં બે હેતુઓ જણાવો.
  - (4) ધંધાની બેંક સાથે થતી નાણાકીય લેવડ - દેવડના મુખ્ય પ્રકારો જણાવો.
- પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના ઉત્તર આપો. (પાંચમાંથી ચાર) (૧૨)
- (1) રોકડ અને ઉધાર વ્યવહાર વચ્ચેનો તફાવત આપો.
  - (2) આમનોંધના લક્ષણો જણાવો.
  - (3) ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી વચ્ચેનો તફાવત જણાવો.
  - (4) જમાખર્ચી વ્યવહાર - સમજાવો.
  - (5) પાસબુક મુજબ જમાબાકી જ્યારે રોકડમેળ મુજબ ઉધાર બાકી એટલે બેંકસિલકનું કારણ જણાવો.
- પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો (પાંચમાંથી ત્રણ) (૧૫)
- (1) રોકડમેળ મુજબ બેંકસિલક અને પાસબુક મુજબ બેંકસિલક વચ્ચેનો તફાવતના કારણો જણાવો.
  - (2) ખરીદનોંધ અને તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો.
  - (3) કાચું સરવૈયું તૈયાર કરવાની સરવાળા પદ્ધતિ અને બાકીની પદ્ધતિ સમજાવો.
  - (4) વેપારી ધોરણે અને રોકડના ધોરણે હિસાબો રાખવાની પદ્ધતિઓ સમજાવો.
  - (5) પેટાનોંધ એટલે શું? પેટાનોંધના પ્રકારો સમજાવો.

**ENGLISH VERSION**

- Que-1 Answer the following questions in short. (08)
- (1) State types of assets.
  - (2) Which types of transactions are recorded in journal proper?
  - (3) State two objectives of trial balance.
  - (4) Describe main types of exchange transaction of business on with bank.
- Que-2 Answer any four from the following questions. (12)
- (1) Distinguish between cash and credit transaction.
  - (2) Describe the characteristic of journal.
  - (3) Distinguish between debit note and credit note.
  - (4) Explain - Contra transaction.
  - (5) Give the reason for bank balance means credit balance as per passbook and debit balance as per cashbook.
- Que-3 Answer in detail any three from the following question. (15)
- (1) State reasons for difference between balance as per cashbook and passbook.
  - (2) Explain the purchase book and types of purchase book with example.
  - (3) Explain total method and balance method.
  - (4) Explain the methods of maintaining accounts on mercantile system and cash system (Basis)
  - (5) What is meant by subsidiary books are these? Explain the types of subsidiary books.